

**જાહેરાત**

ખેતી નિયામકની કચેરી, કૃષિ ભવન, સેક્ટર-10/એ, ચ- રોડ,  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર-382010.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (ઓઇલસીડ & ઓઇલપામ) યોજનાના અમલીકરણ માટે ખેતી નિયામકશ્રીની કચેરી, પાક શાખા, ત્રીજો માળ, કૃષિ ભવન, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ ૧૧ માસ માટે કરારના ધોરણે નીચે મુજબની જગ્યા પર ટેકનીકલ સપોર્ટ ગ્રુપ માટે તદ્દન હંગામી ધોરણે રાજ્યકક્ષાએ કન્સલટન્ટ અને ટેકનીકલ આસીસ્ટન્ટની તથા જિલ્લાકક્ષાએ ટેકનીકલ આસીસ્ટન્ટની નિમણૂકો આપવાની થાય છે. આ જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબના પ્રમાણપત્રો(અસલમાં) તથા તેની પ્રામાણીત ઝેરોક્ષ નકલ સાથે તા.03/0૫/૨૦૧૮ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખેતી નિયામકની કચેરી, APIC સેલ, પોડીયમ લેવલ, કૃષિ ભવન, સેક્ટર-૧૦/એ, ચ રોડ, ગાંધીનગર-૩૮૨૦૧૦ ખાતે રૂબરૂ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અરજી પત્રકનો છાપેલ નમૂનો ઉપરના સરનામા ઉપરથી તે દિવસે મેળવી લેવાનો રહેશે.

જગ્યાનું નામ	જગ્યાની સંખ્યા	માસિક પગાર (રૂ.)	શૈક્ષણિક લાયકાત	પસંદગી માટેની પદ્ધતિ
રાજ્ય કક્ષા કન્સલટન્ટ	૧	૫૦૦૦૦/-	1. પી.એચ.ડી. ઈન એગ્રોનોમી / એગ્રી. એક્સટેન્શન / સોઇલ સાયન્સ / પ્લાન્ટ બ્રીડીંગ/ પ્લાન્ટ પ્રોટેક્શન/ કોપ ઈમ્પ્રુવમેન્ટ તથા પાક ઉત્પાદન / વિસ્તરણનો ૧૦ વર્ષ નો અનુભવ <u>અથવા</u> ઉપરના વિષયોમાં માસ્ટર ડીગ્રી તથા પાક ઉત્પાદન નો ૨૦ વર્ષ નો અનુભવ 2. કોમ્પ્યુટર સ્કીલ- કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી.	<u>મેરીટ અને ઈન્ટરવ્યુ પદ્ધતિથી</u>
રાજ્ય કક્ષા ટેકનીકલ આસીસ્ટન્ટ	૩	૨૫૦૦૦/-	• એમ.એસ.સી. (એગ્રી.) + કોમ્પ્યુટર સ્કીલ- કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી.	<u>મેરીટ પદ્ધતિથી</u> ૧. શૈક્ષણિક લાયકાત માટેની બેઝીક ડીગ્રીમાં મેળવેલ ગુણના ૮૦ ટકા વેઇટેજ, અને
જિલ્લા કક્ષા ટેકનીકલ આસીસ્ટન્ટ	૩૩	૨૦૦૦૦/-	• બી.એસ.સી. (એગ્રી.) + કોમ્પ્યુટર સ્કીલ	૨. NFSM/ NMOOP યોજના હેઠળ ૧૧ માસની એક ટર્મ (ઓછામાં ઓછા ૬ માસની કામગીરી) કે તેથી વધુ ફરજ બજાવેલ હોય તેવા ઉમેદવારને ૨૦ ટકા વેઇટેજ

- નોંધ : સરકારશ્રીના તા.15.03.2012ના ઠરાવ મુજબ નિવૃત્ત સરકારી અધિકારી/કર્મચારીઓ અરજી કરી શકશે નહીં.
- દરેક જગ્યા માટે અલગ -અલગ અરજી કરવાની રહેશે.

અરજી સાથે બિડાણ કરવાના પ્રમાણપત્રો : 1.સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ, 2. ડીગ્રી સર્ટીફિકેટ તથા માર્કસીટ, 3. કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર, 4. અનુભવ અંગેનું પ્રમાણપત્ર, 5. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

અરજીપત્રક સાથે તમામ સાધનિક કાગળની પ્રામાણિત નકલો બીડવાની રહેશે. ઉપરોક્ત તમામ અસલ પ્રમાણપત્રો પસંદગી બાદ હાજર થઈ રજૂ કરવાના રહેશે. અધૂરી વિગતોવાળા તથા જરૂરી લાયકાત ન ધરાવતા હોય તેવા ઉમેદવારની અરજીઓ રદબાતલ થવા પાત્ર રહેશે. અરજી ગુજરાતીમાં કરવાની રહેશે. પસંદગી પ્રક્રિયા મેરિટના ધોરણે હાથ ધરવામાં આવશે તથા પસંદગી પામેલ ઉમેદવારોને ઇ-મેઇલ અને ટપાલથી જાણ કરવામાં આવશે.

સહી/-

ખેતી નિયામક

ગુજરાત રાજ્ય, ગાંધીનગર.